

જૂન 27, 2018

## બ્રામ્પટનને ચોખ્ખું, સુરક્ષિત અને આકર્ષક બનાવવાને પ્રોત્સાહન આપવા આ શહેર બે નવા પેટાકાનૂનો બનાવે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – બ્રામ્પટન સીટી કાઉન્સિલે તાજેતરમાં બે નવા પેટાકાનૂનો (બાય-લોઝ) મંજૂર કર્યા જે શહેરની ગુણવત્તા જાળવવા પર ધ્યાન આપે – અનધિકૃત પાર્કિંગ પેટાકાનૂન (અનઓથોરાઈઝડ પાર્કિંગ બાય-લો) અને સાર્વજનિક ત્રાસ પેટાકાનૂન (પબ્લિક ન્યુસન્સ બાય-લો).

### અનધિકૃત પાર્કિંગ પેટાકાનૂન (અનઓથોરાઈઝડ પાર્કિંગ બાય-લો)

મે 30, 2018 નાં રોજ, કાઉન્સિલે ઘાસના બુલેવાર્ડ્સ અને ઘરની આગળ અને બાજુના યાર્ડ્સ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવતા વાહનોને નિયંત્રિત કરવા અનધિકૃત પાર્કિંગ પેટાકાનૂન મંજૂર કર્યો. નવા પેટાકાનૂન હેઠળ, અધિકારીઓ સપાટ સિવાયની જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવતા વાહનો માટે \$75 ની પાર્કિંગ પેનલ્ટી નોટિસ આપી શકે છે. પેનલ્ટી નોટિસો હવેથી કાયદાની અમલ બજાવણી કરતા અધિકારીઓ દ્વારા આપી શકાશે, જેઓ દિવસના 24 કલાક પેટ્રોલિંગ કરતા હોય છે.

ભૂતપૂર્વ પેટાકાનૂન હેઠળ, મિલકત ધોરણ હુકમો (પ્રોપર્ટી સ્ટાન્ડર્ડ ઓર્ડર્સ) ત્યારે આપવામાં આવતા હતા જ્યારે વાહનો ઘરની આગળ કે બાજુના યાર્ડ્સ પર પાર્ક કરવામાં આવે અને પેનલ્ટી નોટિસો ત્યારે આપવામાં આવતી જ્યારે વાહનો લેન્ડસ્કેપ બુલેવાર્ડ્સ પર પાર્ક કરવામાં આવે. ઘાસના બુલેવાર્ડ પર વાહન પાર્ક કરીને ઉલ્લંઘન કરનારાઓને \$35 ની ટિકિટ આપવામાં આવતી, અને ખાનગી આગળ કે બાજુના યાર્ડ પર પાર્ક કરનારાઓને પોતાના વાહનો ખસેડીને કાયદા સાથે સુસંગત રહેવા લઘુત્તમ 21 દિવસનો સમય આપવામાં આવતો હતો. વધુમાં, મૂકેલા આરોપોનો ઉકેલ આપવામાં એક વર્ષ સુધીનો સમય લાગી શકતો હતો.

આ નવો પેટાકાનૂન કાયદાની અમલ બજાવણી કરતા કર્મચારીગણને આગળ અને બાજુના યાર્ડ્સને સંબંધિત પાર્કિંગ ફરિયાદો પર ઓછો સમય વિતાવવા દેશે, જેનાથી અન્ય નોંધપાત્ર પેટાકાનૂન મુદ્દાઓ પર માનવ સંસાધનોની પુનઃકાળવણી કરી શકાશે, જેની સાથે સાથે સ્થાનિક પડોશનો દેખાવ સુધારી શકાશે.

### સાર્વજનિક ત્રાસ પેટાકાનૂન (પબ્લિક ન્યુસન્સ બાય-લો)

ત્રાસમય જૂથો વધવાને જવાબ આપવામાં જ્યાં ઘોંઘાટિયું અને ધૂણાપાત્ર વર્તન અઠવાડિક રોકાણો, લગ્નો કે અન્ય ખાસ પ્રસંગો માટે આવાસીય મિલકતો ભાડે આપતા લોકો દ્વારા કરવામાં આવતું હોય, કાઉન્સિલે જૂન 27, 2018 નાં રોજ સાર્વજનિક ત્રાસ પેટાકાનૂનને મંજૂરી આપી હતી.

આ પેટાકાનૂન રહેવાસીઓ અને તેઓના મહેમાનો દ્વારા અપમાનકારક અને/અથવા અશિષ્ટ વર્તન અને ક્રિયાઓ, અશ્લીલતાનો ઉપયોગ, અને સંભવિતપણે કોઈ બીજા વિચ્છેદક વર્તનના મુદ્દાઓને સંબોધશે. તે વિવિધ અન્ય સાર્વજનિક ત્રાસને પણ સંબોધશે જેમાં રસ્તા પર ભીખ માંગવી, ભીંતચિત્રો દોરવા અને સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડવું, અને વાંધાજનક દુર્ગંધ કે ધૂમાડો, ધૂળ કે હવામાં ઊડતા કણોના સ્ત્રાવને પ્રતિબંધિત કરવું સામેલ છે, શહેરે પરવાનગી આપી હોય તે સિવાય.

સાર્વજનિક ત્રાસ પેટાકાનૂન શહેરના કાયદાની અમલ બજાવણી કરતા કર્મચારીગણ અને પોલીસને ત્રાસદાયક જૂથો અને અન્ય સાર્વજનિક ત્રાસ સાથે ઘેરાયેલા મુદ્દાઓને પહોંચી વળવામાં વધારાના સાધનો પૂરા પાડશે અને સહાયતા કરશે.

પેટાકાનૂનો આ શહેરની ગુણવત્તા જાળવવામાં મદદ કરે છે, અને દરેક બ્રામ્પટનિયને આ ધોરણોને ટેકો આપવામાં કંઈક ભૂમિકા ભજવવાની હોય છે. રહેવાસીઓ અને મુલાકાતીઓને શહેરના પેટાકાનૂનો અનુસરીને બ્રામ્પટનની સુખાકારીમાં ફાળો આપવા પોતાનો ભાગ ભજવવાનું કહેવામાં આવે છે જેથી કરીને દરેક વ્યક્તિ ચોખ્ખા, સુરક્ષિત શહેરનો આનંદ માણી શકે તેવી ખાતરી કરવામાં મદદ મળી શકે.

આ અને અન્ય પેટાકાનૂનો પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [www.brampton.ca/bylaws](http://www.brampton.ca/bylaws)